

ત્વરિત જાહેરાત માટે

## પોપ સેન્સેશન લાઈટ્સ બ્રેમ્પટનના વર્ષનાં સૌથી મોટા ઉત્સવ: કેનેડા ડે ને મહોત્સવ બનાવશે!

બ્રેમ્પટન, ઓન્ટારિયો (12 જૂન 2019) – સોમવાર, જુલાઈ 1ના રોજ ચિંગકુઝી પાર્ક ખાતે કેનેડા ડે નિમિત્તે જે બ્રેમ્પટનનો વર્ષનો સૌથી મોટો ઉત્સવ છે તેમાં અદ્ભૂત વ્યંજનો, ક્રાફ્ટ બિયર, પરિવાર માટેની મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ, જોરદાર આતશબાજી અને રોમાંચક સ્ટેજ શો માટે તૈયાર રહો. સીટીને આ વર્ષનાં મુખ્ય કલાકારનું નામ જાહેર કરતા રોમાંચની લાગણી થાય છે. રજૂ થાય છે JUNO વિજેતા કેનેડિયન ગાયક/ગીતકાર, લાઈટ્સ

ઇવેન્ટ જુલાઈ 1ના રોજ મધ્યાહ્નથી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલશે. મંચ પર મુખ્ય પ્રદર્શન સાંજે 6 વાગે બ્રેમ્પટન આર્ટ્સ વોક ઓફ ફેમ અનુગામી અને પાંચ વખતના JUNO પુરસ્કાર વિજેતા એક્સકો લેવિ (Exco Levi) અને હાઈ પ્રિસ્ટ (High Priest)ના પ્રદર્શનથી શરૂ થશે. કેનેડિયન પોપ જોડી એલિજા વૂડ્સ x જેમિ ફાઈન (Elijah Woods x Jamie Fine) જેઓ તેમના ડબલ પ્લેટિનમ પ્રમાણિત ડેબૂ સિંગલ "એઈન્ટ ઈઝી (Ain't Easy)" માટે વિખ્યાત છે તેઓ ઓલ્ટ-પોપ સેન્સેશન લાઈટ્સ માટે ખેલ શરૂ કરશે જેઓ તેણીના હાઈ-એનર્જી, ઈલેક્ટ્રોનિક પર્ફોર્મન્સથી શોનું મથાળું બનશે જેમણે આખી દુનિયામાં સોલ્ડ આઉટ ટૂર કરી છે.

આખો દિવસ કોમ્યુનિટી એરિયામાં પ્રવૃત્તિઓ હોસ્ટ કરવામાં આવશે (જે બ્રેમ્પટન ઓટોમોબિલ દ્વારા પ્રસ્તુત થશે) જેમાં રમતો, હસ્તકલા, આર્ટ ઈન્સ્ટોલેશનો, ફોટો ઓપર્યુનિટીઝ, સામુદાયિક કલાના પ્રોજેક્ટ્સ અને બીજું ઘણું બધું હશે. સહભાગીઓ આખા દિવસ દરમિયાન સ્વેશ પેડ અને પેટિંગ ઝૂ એટલેકે પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકશે, મિનિ-ગોલ્ફનો રાઉન્ડ અજમાવી શકશે, અથવા દિવસ દરમિયાન આરામદાયક પેડલ બોટની સવારી પણ કરી શકશે. આ બધી પરિવાર માટે અનુકૂળ સુવિધાઓ મધ્યાહ્ન થી સાંજે 6 સુધી ખુલ્લી રહેશે.

કેનેડાના જન્મદિનનું સ્મરણ અપાવવા રાત્રે 10 વાગ્યે ટિમ હોર્ટન દ્વારા એક અદ્ભૂત આતશબાજીનો કાર્યક્રમ રજૂ કરાશે.

આ વર્ષે નવું એટલે બે ફૂડ ઝોન્સમાં વિશ્વભરનાં વ્યંજનોની શ્રેણીથી ભરપૂર ગૂરમે ફૂડ ટ્રક્સ, વિક્રેતાઓ અને ક્રાફ્ટ બિયર ગાર્ડન રજૂ થશે. અમારી ગ્રીન સીટીની પહેલોના ભાગરૂપે વિક્રેતાઓ ફૂડ પેકેજિંગ માટે પર્યાવરણ માટે અનુરૂપ વિકલ્પોનો ઉપયોગ કરશે. આખા પાર્કમાં ઠેકઠેકાણે મેરિડિયન દ્વારા પૂરી પાડવામાં આવેલ પાણીની પરબોનો લાભ લેવા માટે મહેમાનોને ફ્રી વાપરી શકાય એવી પાણીની બોટલ સાથે લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ચિંગકુઝી પાર્ક (Chinguacousy Park) 9050 બ્રેમલિ રોડ ખાતે સ્થિત છે. ઓન-સાઈટ પાર્કિંગ મર્યાદિત છે અને હંગામી ધોરણે રોડ ક્લોઝર્સ મુકવામાં આવશે. સહભાગીઓને ચાલવા, પોતાની બાઈકની સવારી કરવા, અથવા તે દિવસે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા આપવામાં આવનાર મફત શટલ સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મફત શટલ સેવા નીચેના સ્થળો પરથી મેળવી શકશો:

- માઉન્ટ પ્લેઝન્ટ GO સ્ટેશન
- ટ્રિનિટી કોમન મોલ
- શેરિડાન કોલેજ
- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર અને ગ્રંથાલય (Gore Meadows Community Centre and Library)

વધુ માહિતી માટે જેમાં વિગતવાર ઈવેન્ટ લાઈન અપનો સમાવેશ હોય, અહીં મુલાકાત લો [www.brampton.ca/canadaday](http://www.brampton.ca/canadaday) અથવા 311 પર સર્વિસ બ્રેમ્પટનને કોલ કરો.

### અવતરણ

"કનેડાના 152માં જન્મદિન નિમિત્તે હું બ્રેમ્પટનના પરચરંગી સમાજને વધાવી લેવા માટે તમામ નાગરિકોને આમંત્રણ આપું છું! આખો દિવસ સ્થાનિક કલાકારો અને સંસ્થાઓ, કનેડાના ઉત્કૃષ્ટ અદાકારો, સ્વાદિષ્ટ આંતરરાષ્ટ્રીય ફૂડનાં સ્વાદથી ઉભરાશે અને રોમાંચક આતશબાજીનું પ્રદર્શન તો ખરૂં જ. આપનું કેનેડિયન ગૌરવ દર્શાવો અને બ્રેમ્પટનનાં ફ્લેગશીપ પાર્કમાં એક અદ્ભૂત દિવસને માણી લેશો."

- મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

-30-

કનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કરી શકીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)